

ગુજરાત યુનિવર્સિટી

નં/સંકેડી/કા/બી/૬૦૬૩/૧/૨૦૦૬

ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય

અમદાવાદ તા ૨૬/૫/૨૦૦૬

પારિપત્ર નંબર

આથી Life Science મત્રાલય ના ૧૩૨૬૮૫૫ નાં  
કુલપતિના આદેશાનુસાર ગણાવવાનું કે નાસ્ક પૃષ્ઠ  
નાં Paper ના Elective microbial technology  
નાં Paper ઠાવવા સલામત રીતે એ નાં આ.  
સાથેના પારિપત્ર મૂકવા એ નાં ઠાવવા એ નાં  
June ૨૦૦૬ થી સલામત રહેશે  
કોડિસાઈ: ૩૫૨ મુદ્રણ

  
કુલપતિ

પ્રતિ,

૧) મત્રાલય, Life Science Dept, School of Science  
Gujarat University Ahmedabad

૨) ગોમતી પ્રકલ્પાલેન ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટી  
અમદાવાદ

૩) પરીક્ષા નિયામકશ્રી, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ

૪) ગંજાપાલશ્રી, ગુજરાત યુનિવર્સિટી ગંજાપાલ અમદાવાદ

**LIFE-SCIENCES DEPARTMENT**  
**M.Sc PART-II**  
**Paper –VI : ELECTIVE**  
**MICROBIAL TECHNOLOGY**

**1. ELEMENTS OF MICROBIAL TECHNOLOGY**

- (i) Sources of Industrial microbes : Isolation, Selection and screening of industrially important microbes.
- (ii) Strain improvement programme.
- (iii) Media formulations for fermentation process.
- (iv) Bioreactor design.
- (v) Optimization of fermentation process.

**2. UPSTREAM AND DOWNSTREAM PROCESSING**

- (i) Sterilization of bioreactor, air and media
- (ii) Inoculum development
- (iii) Aeration and agitation
- (iv) Foam control
- (v) Recovery and purification of products.

**3. BIOPROCESS TECHNOLOGY**

- (i) Scale-up in bioprocess
- (ii) Control of bioprocess parameters
- (iii) Fermentation kinetics
- (iv) Fermentation Economics
- (v) Quality assurance

**4. TYPICAL MICROBIAL FERMENTATION PRODUCTS**

- (i) Antibiotics : Penicillin and/or Streptomycin
- (ii) Enzymes : Amylase and/or Protease
- (iii) Organic acids : Citric acid and/or Lactic acid
- (iv) Organic solvents : Ethanol and/or Butanol
- (v) Amino acids : Lysine and/or Glutamic acid
- (vi) Vitamins : B<sub>12</sub> and/or B<sub>2</sub>

**5. MICROBIAL BIOMASS & ECO-FRIENDLY BIOTECHNOLOGICAL PROCESSES**

- (i) Biofertilizers
- (ii) Bioinsecticides
- (iii) Bio foods : Edible mushrooms, SCP, Edible algae.
- (iv) Biopolymers : Bioplastic, Xanthan, Dextran
- (v) Biofuels : Gasohol, Biogas, Hydrogen
- (vi) Bioleaching and MEOR.